

Date: 30/06/ 2021

To,
Gen. Manager (DCS)
BSE Limited.
P J Towers, Dalal Street,
Fort, Mumbai-400001

SUB: INTIMATION OF ADVERTISEMENT IN NEWSPAPER UNDER REGULATION 47 OF SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS 2015.

REF: COMPANY CODE BSE: 531257 (PRATIKSHA CHEMICALS LIMITED)

Dear Sir,

Please find enclosed herewith copy of Advertisement given in newspaper of audited financial results for the quarter and year ended on 31st March, 2021 in compliance of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The said financial results were reviewed by Audit committee and approved by the Board of Directors at its meeting held on 29th June, 2021.

You are requested to take the same on your record.


Thanking You.

Yours Sincerely,

FOR, PRATIKSHA CHEMICALS LIMITED

U L Adhvaryu

**MR. UPENDRA ADHVARYU
DIRECTOR
(DIN: 00483857)**



PRATIKSHA CHEMICALS LIMITED

Regd. Off : 3rd Floor, H. K. Complex , Nr. Dharnidhar Derasar, Paldi, Ahmedabad-380 007 India
Ph. 26632390, 26609530 Fax No : +91 79 26612843.

Website : <http://www.dharapratiksha.com> E-mail : exports@dharapratiksha.com

CIN : L24110GJ1991PLC015507

Factory : 195/2, Near Natraj Industrial Estate, Village Iyawa Vasna, Sanand.
(Dist : Ahmedabad) India. Phone 02717-284350

CHANAKYA

NI POTH

Edtech startup upGrad set to join unicorn club with \$4-billion valuation

Temasek-backed edtech startup upGrad is in talks with global private equity and venture capital investors to raise \$400 million at a valuation of \$4 billion, according to sources close to the development. This would mean almost a five-fold jump in the valuation of the Mumbai-based startup from the last fund-raise round earlier this year.

The company is also planning to close two significant acquisitions—a global short-form course player and another in the executive education space—in the next two to three months.

Founded in 2015, the higher education and upskilling company has so far raised \$160 million in two separate external rounds this year led by Temasek and IFC. At the last fund raise earlier this year, upGrad was valued at close to \$850 million. The company was completely bootstrapped before this.

When contacted, upGrad chairman and co-founder Ronnie Screwvala declined to comment on the fundraise. When asked about the acquisitions, their fourth and fifth so far, he said, “These are significant players who are going to add a lot of value to our group.”

Commenting on the likely

rise in valuation and the prospect of upGrad joining the unicorn club, he said, “We’ve got a lot going on our plate. So, obviously the next jump will happen substantially higher than a unicorn.”

With this round, the company is all set to join the likes of edtech players including BYJU’s and Unacademy and enter the unicorn club. Unacademy had become a unicorn last September when it raised \$150 million in a round led by Japanese conglomerate SoftBank valuing it at \$1.45 billion, a three-fold jump in just six months. BYJU’s, which has seen a meteoric rise in its valuation, has raised a total of \$2.7 billion in funding over 18 rounds, according to Crunchbase data. It doubled its valuation from \$8 billion in January 2020 to \$16.5 billion in June this year, becoming the most valuable startup in the country, beating Paytm. Two other edtech startups—Vedantu and Eruditus—are eyeing unicorn valuation this year.

upGrad is focusing on revenue growth and is looking at up to three times jump between Q1 and Q4 of FY22 in its topline numbers, which it expects to cross \$500 million in annual revenue run rate. According to financial data accessed at business

intelligence platform Tofler, the company’s losses had widened to Rs 79 crore in FY20 against Rs 43 crore in FY19.

Founded by Screwvala, Mayank Kumar, Phalgun Kompalli, and Ravijot Chugh six years ago, upGrad had acquired recruitment and staffing solutions company Rekrut India and a Bengaluru-based coaching institute The Gate Academy last year. It has recently acquired video-enabled learning solutions platform Impartus and has committed over Rs 150 crore for the buyout and to invest in its growth.

It is targeting a revenue of Rs 400-600 crore from its five acquisitions, including the ones in short-term courses and executive education by FY23.

In the next six months, upGrad’s total addressable market will cross \$100 billion, of which the working professionals’ market is placed at \$8-10 billion, \$5 billion covers the test preparation sector, \$65 billion comprises the global working professionals and \$20 billion covers short-form courses around the globe. Led by the US, international business will lead to 20 per cent revenue for the company by the end of FY22. The company has international presence in markets such as West Asia, Indonesia, Vietnam, Singapore, the UK and the US.

Twitter India MD Manish Maheshwari files caveat petition in Supreme Court

Twitter India’s Managing Director Manish Maheshwari has filed a caveat in the Supreme Court, dated June 26, asking that he be heard before any orders are passed in any appeal filed by the Ghaziabad police against the relief granted by Karnataka High Court.

The Karnataka HC had on Thursday granted interim relief to Maheshwari in a case relating to an assault video that had gone viral on the microblogging platform. The HC had also directed that no coercive action be taken against him till Tuesday.

The court had remarked that if the Ghaziabad police wished to examine the Twitter MD it could do so virtually.

An email sent to Twitter remained unanswered till the time of going to press.

The UP police had issued a notice to Maheshwari on June 17 to report at the Loni Border police station within seven days of receiving the notice to get his statement recorded. The case relates to

an ongoing complaint related to tweets on the assault of an elderly Muslim man in Ghaziabad.

Twitter on June 21 restricted tweets showing the video and images from it, according to a filing with the Lumen Database by the microblogging platform.

The tweets are withheld for users in India.

Ghaziabad Police said the assault on the Muslim man was a personal dispute but was being painted as a communal incident on Twitter. Some media platforms and journalists were also named in the complaint.

Maheshwari, who is based in Bengaluru, was summoned last week for questioning and had made himself available for a video call, but the police summoned him to appear in person at the Loni Border station.

The lawyer appearing for Maheshwari cited the case of journalist Vinod Dua, where another High Court had allowed investigation through video conferencing.

Strong recovery likely to continue for auto ancillary companies

There’s an interesting divergence of opinions on the auto-ancillary sector. Some analysts and fund managers believe the sector is likely to continue a strong recovery. On the other hand, India Ratings & Research has issued an advisory saying there will be a contraction in the first quarter of financial year 2021-22 (Q1FY22). The longer-term prospects seem good.

The Q4FY21 results were very encouraging. For a sample of 73 auto-ancillary manufacturers, combined revenues rose 36 per cent year-on-year (YoY) to Rs 58,610 crore and PBDIT was up 84 per cent at Rs 7,551 crore, with PAT up 400 per cent to Rs 3,048 crore.

There are multiple companies with PAT expansions of above 100 per cent including Motherson Sumi, Sundaram Clayton, Bosch, Minda, Shriram Pistons, Jay Bharat Maruti, Craftsman Auto, L G Balakrishnan, Jamma Auto, etc.

The forgings and castings industry, which is also connected to the auto value chain, is also doing better with 38 per cent turnover expansion and 97 per cent rise in PBDIT. Operating margins are up around 3 per cent for many companies.

Both industries have seen an expansion in employee costs and a fall in financing costs. Both trends are healthy since they indicate hiring.

Their fortunes are tied to the automobile industry, and there, too, we see improvement. Revenues for 11 listed companies rose by about 36 per cent, PBDIT was up 58 per cent, and PAT 148 per cent. Auto sales are consumption-related and consumer

confidence is critical.

One positive is low interest rates — it is good for the entire value-chain as the sector is working capital intensive. It is also a demand-push factor since vehicles are financed.

A cause for concern is input costs, which are rising because of the global bull market in commodities. This has forced majors like Maruti and Hero to hike prices, which could hurt demand. Higher fuel prices also hurt demand.

Then, there are base effects to consider — Q4FY21 was almost normal, while Q4FY20 was hit by 10 days of lockdown. And in Q1FY21, April and May were washouts. The second wave affected April and May 2021, but not as badly as in the previous year. Hence, the base effects are positive.

India Ratings & Research estimates working capital requirements were higher for ancillaries in Q1FY22 as they needed to hold high inventories to avoid supply chain disruption in the second wave.

Capacity utilisation declined from 90-95 per cent in March, to 55-60 per cent in May. However, demand should pick up in Q2.

Export demand remains strong. Assuming no major disruptions by a third wave, revenues should grow at 18-22 per cent through FY22. Other analysts believe India’s auto ancillary sector has consolidated its market share not only in India, but also in globally, where they are competitive at scale.

If Q1 is disappointing for the sector, and it is a temporary effect, it may create an opportunity for investors to enter at lower levels.

Tata Motors to launch 10 EVs by 2025, 'lead change' on carbon footprint

Tata Motors will aggressively push its presence in electric vehicles (EVs) and launch 10 new battery-electric vehicles by 2025 across segments in India, its chairman, N Chandrasekaran, has said.

The company, which has the largest share of India’s electric car market, will also invest in lithium-ion cell manufacturing in India and Europe to establish a proper supply chain for its zero-emission vehicles in the coming decade.

“In India, EV penetration in our portfolio has now doubled to 2 per cent this year and we expect the penetration to increase exponentially in the coming years. Tata Motors will lead this change in the Indian market. By 2025, Tata Motors will have 10 new BEV vehicles,” Chandrasekaran said, addressing shareholders in the annual report for FY 21.

This comes at a time when the government is nudging automobile makers to develop and manufacture EVs to reduce carbon footprint, and has brought out policies offering incentives to buyers opting for such vehicles.

The Securities and Exchange Board of India (Sebi) has kept the approval of Go Airlines (India)’s Rs 3,600-crore initial public offering (IPO) in abeyance.

While the airline denied receiving any communication from the stock market regulator, Sebi’s website shows that it had sought clarifications from ICICI Sec-urities, the lead banker for the pre-issue, on June 11. The issuance of observations on the airline’s draft red herring prospectus has been kept in abeyance, it said.

The Wadia-group owned airline was rebranded as Go First, positioning itself as an ultra-low-cost airline and filed papers last month to raise Rs 3,600 crore through a share sale. It plans to use the proceeds to meet its debt obligations, pay oil companies, replace letters of credit given to aircraft lessors towards lease rent, and future maintenance of aircraft.

In this case the exact observations issued by Sebi could not be ascertained, but the regulatory action could delay the airline’s fundraising plans.

According to documents

In the FY22 Budget, the government announced the lowering of goods and services tax on EVs to 5 per cent from 12 per cent, and offered income-tax incentives to individuals purchasing EVs.

Currently, Tata Motors has two fully electric models -- Nexon EV and Tigor EV -- in the market. The electric version of the Altroz is expected to be launched in the coming months. The Nexon EV is India’s best-selling electric passenger vehicle with sales of more than 4,000 units since its launch in January 2020.

The development of an EV ecosystem, from manufacturing to battery plant to after-sales service, requires collaboration from a diverse set of businesses. The Tata group has been one of the early identifiers of this challenge and have marshalled the expertise of group companies into building it.

At the launch of Nexon, the company’s first EV, Chandrasekaran had announced that seven Tata group companies -- Tata Motors, Tata Power, Tata Chemicals, Croma, Tata Auto Components, and Tata Motors

Finance -- would work together to build a complete ecosystem for EVs.

Earlier this year, the company’s British subsidiary, Jaguar Land Rover, announced that six out of every 10 Land Rover models would go electric by 2030 as it ditches the combustion engine in favour of the zero-emission technology as part of its ‘Reimagine’ strategy.

Tata Motors’ peers have diverse strategies towards cleaner mobility. While the largest carmaker, Maruti Suzuki, is pinning its hopes on CNG vehicles, Mahindra & Mahindra has reorganised and set up a separate vertical for the EV business.

Analysts said high fuel prices and the government’s subsidy push would act as supporting factors for stronger adoption of EVs over 2020-2023, leading to an average annual growth rate of 26 per cent. “We believe the focus on EV promotion in the Union Budget will improve longer-term outlook for EV sales but will continue to fall way short of the country’s goal of electrifying all new vehicles sold by 2032,” Fitch Solutions said in a recent report.

Sebi keeps approval to Go Air's Rs 3,600-crore IPO in abeyance

Issuance of observations by Sebi implies approval for a public offering. As the market regulator, it is Sebi’s job to vet documents submitted by companies before giving them the go-ahead for an IPO. It is a common practice for the regulator to raise queries to investment banks on an offer document.

Market experts said, typically, an IPO issue is kept in abeyance when the violation is serious in nature. They said it could take a company more than a month to address the issue before the regulator begins the vetting process afresh.

In this case the exact observations issued by Sebi could not be ascertained, but the regulatory action could delay the airline’s fundraising plans.

According to documents

filed with Sebi, the Wadia family and their company Go Investment hold 100 per cent stake in the airline. At least 22.56 per cent of Go Investment is pledged with a lender’s consortium. In the nine month ending December 2020, the airline posted a loss of Rs 470 crore on total income of Rs 1,438 crore. The airline posted a loss of Rs 1,270 crore in FY20 on an income of Rs 7,258 crore, according to consolidated financial statements that were part of the IPO filing.

While negotiations with lessors were highlighted as risk factors in the prospectus, the airline has been able to negotiate a longer repayment schedule for one of its loans with the French lender BNP Paribas.

It has also received positive feelers from lessors for further deferment of lease payment on account of the second wave of the pandemic.

MSCI warns India, four other emerging markets against restrictive policies

Global index provider MSCI has warned India and four other emerging markets (EMs) against restrictive policies, and reiterated that any move that impedes overseas investment could lead to a downgrade.

“Low ratings continue to persist for the availability of investment instruments in the market accessibility criteria for Brazil, China (A shares), India, Korea, and Turkey. Global market participants expect that stock exchanges should not directly or indirectly restrict the availability of investment instruments domestically or globally,” MSCI said in a release, where it stripped Argentina of its EM status owing to the country’s continued capital controls.

MSCI’s popular indices such as the MSCI Emerging Markets Index and the MSCI Asia Pacific ex Japan Index are tracked by funds with trillions of dollars of investments. As a result, any change in the weighting of a country or stock results in millions of dollars of churn.

China, South Korea, and India are among the top markets in the EM basket. Given the status of these markets, experts said, it is improbable that MSCI would cut the EM status, but it could reduce the so-called foreign inclusion factor (FI), which will result in lower weightings and hit foreign inflows.

India currently has about 10 per cent weighting in both the MSCI EM and Asia Pacific ex Japan indices. “As a reminder, any anti-competitive policy put forth by any exchange in any market in the world that restricts the

availability of investment instruments and results in deterioration of the accessibility of an equity market could potentially lead to a downgrade in market classification. Exchanges and regulators should note that anti-competitive policies or practices that restrict the availability of indexed investment instruments have become increasingly problematic to global investors,” the MSCI release further said.

“Regulators are increasingly placing market development high on their list of priorities. It is important to manage any resulting cross-border issues taking into account the interests of end investors. The other issue is, market classification decisions are becoming increasingly complicated. In this scenario, when investment flows are directed based on decisions of a dominant index provider, it increases the risks for markets as well as investors,” he said.

An email sent to MSCI, seeking more details on the issue, went unanswered. In a separate note released earlier this month on market accessibility review, MSCI highlighted key issues pertaining to the Indian markets. These included less legroom available for foreign portfolio investors (FPIs) in several Indian stocks, lack of formal mechanism that allows FPIs to trade among themselves, no offshore currency market and constraints on the onshore currency market, and a complex framework for governing foreign investments.

MSCI also highlighted restrictions imposed on the use of stock market data as a concern. In 2018, India’s bourses had ended their data-sharing pact with their global counterparts in a bid to curb trading in Indian securities in the overseas market.

While India is the second-

biggest market in Asia (excluding Japan and Hong Kong) and the EM pack, issues surrounding access to FPIs have constrained India’s weighting. As a result, in the Asia Pacific ex Japan Index, Australia, Taiwan and South Korea enjoy a higher weighting compared to India.

Sivananth Ramachandran, director of Capital Markets Policy (India), CFA Institute, said given the changing landscape of investment flows, these issues were getting increasingly complicated.

“Regulators are increasingly placing market development high on their list of priorities. It is important to manage any resulting cross-border issues taking into account the interests of end investors. The other issue is, market classification decisions are becoming increasingly complicated. In this scenario, when investment flows are directed based on decisions of a dominant index provider, it increases the risks for markets as well as investors,” he said.

Last year’s move by the Indian government to raise the statutory FPI limit of Indian companies to the sectoral foreign investment limit was hailed by MSCI and FTSE. Both index providers had increased India’s weighting in its global indices, a move that had helped boost foreign flows.

“Although the changes were significant and the percentage of the affected Indian equity market by foreign ownership limits has been reduced to 13 per cent, these limitations still affect more than 10 per cent of the Indian equity market,” MSCI has said.



PRATIKSHA CHEMICALS LIMITED					
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007					
CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in					
PH : 079-26632390 E-MAIL: exports@dharaipratiksha.com					
EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31.03.2021 (Rs. In Lacs)					
Sr. No	PARTICULARS	Quarter ended on 31st March, 2021	For the year ended on 31st March, 2021	Corresponding 3 Months Ended on 31st March, 2020	For the previous year ended on 31st March, 2020
1	Total income from operations	446.80	1136.12	376.34	1610.01
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	12.587	42.64	(3.95)	11.46
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12.587	42.64	(3.95)	11.46
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	16.69	46.64	(28.01)	(15.99)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	16.69	16.69	(28.01)	(15.99)
6	Equity Share Capital	557.03	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	(232.46)	(232.46)	(279.10)	(279.10)
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	0.30	0.84	(0.50)	(0.29)
	Basic :	0.30	0.84	(0.50)	(0.29)
	Diluted :	0.30	0.84	(0.50)	(0.29)

Notes:

- The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
- The result of the Quarter ended on 31st March, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 29th June, 2021.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED

SD/-

Mr. UPENDRAADHIVARYU
DIRECTOR
(DIN : 00483857)

Place : Ahmedabad
Date : 29th June, 2021

ધી ન્યુઝલાઇન

વર્ષ : ૨૭ અંક : ૨૫૫ તા.૩૦-૦૬-૨૦૨૧ પાનાં ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

માસ્ટેકના શેરમાં મજબૂત ઉછાળાની ગણતરી

ગયા અઠવાડિયા દરમિયાન મુંબઈના ખેલાડીઓએ થોડીક અલગ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી હતી અને તેમાં બહમતી મીડકેપ અને સ્મોલકેપ શેરોને થોડા નીચા લાવવામાં આવ્યા છે અને કદાચ આ સ્ટ્રેટેજી ગણિત એ છે કે તે રીતે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં હજી વધારે ઉછાળો લાવી શકાય.

આગામી દિવસોમાં **માસ્ટેક**ના શેરમાં મજબૂત ઉછાળાની ગણતરી છે. રૂ. ૨૨૭૬ ઉપર આવી ગયેલા આ શેર અન્ય આઈટી કંપનીઓની સાથે સાથે ઝડપથી ઉચકાઈ જવાની સંભાવના દેખાય છે. આગામી દિવસોમાં રૂ. ૨૩૦૦ અને તે પછીના ઉછાળે રૂ. ૨૩૬૦નો ભાવ જોવા મળવાની

રૂ. ૧૧૩ ઉપર આવી ગયેલા **તામિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સ**ના શેરમાં હજી લાંબી તેજની જગ્યા



૨૨૩૬ના ભાવે આ શેર લેવાની વાત કરી હતી અને અત્યારે વધીને રૂ. ૨૪૨૩ ઉપર આવ્યો છે. આગામી દિવસોમાં આ શેરમાં તોતીંગ ઉછાળો જુદું છે અને ઉપરમાં રૂ. ૨૪૪૫ અને તે પછીના ઉછાળે રૂ. ૨૫૧૫નો ભાવ ક્યાં આવી જશે તે પણ ખબર નહિ પડે અને તે પછી પણ તેજ ચાલુ રહેવાની ગણતરી છે.

શોર્ટટર્મ ખેલાડીઓનું આકર્ષણ **મેક્સ ફિનાન્સીયલ**ના શેરમાં જોવાય છે. આ કંપનીએ મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સનું હોલિંગ એક્સિસ બેંકને વેચ્યા પછી તેમાં ઉછાળો જોવાયો છે. અત્યારે રૂ. ૧૦૮૪ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૧૧૦૮ અને તે પછીના ઉછાળે રૂ. ૧૨૦૦નો ભાવ આવી જવાની સંભાવના.

કોરોમંડલ ઇન્ટરનેશનલ અત્યારે રૂ. ૯૨૯ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં રૂ. ૯૫૩ અને તે પછી રૂ. ૧૦૨૦નો ભાવ આવી જવાની ગણતરી. મરુગપ્પા ડ્રૂપની કંપની છે અને તેમાં નફો જોરદાર આવશે.

શોર્ટટર્મ ખેલાડીઓની લેવાલી **સીઈએસસી**ના શેરમાં પણ વધતી જાય છે. ગયા અઠવાડિયે પણ આ શેર લેવાનું દર્શાવેલું. અત્યારે રૂ. ૭૭૩ ઉપર આવ્યો છે અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં રૂ. ૭૭૮ અને તે પછી રૂ. ૭૮૯નો ભાવ જોવા મળવાની ગણતરી.

એક્ઝેમ્પ્લિસ શેરોની સાથે સાથે પેકેજિંગ મટીરીયલ બનાવતી કંપનીઓમાં પણ ખૂબ સુંદર ઉછાળો છે

અને તેમાં **ઈપીએલ લિમિટેડ** રૂ. ૨૮૧ના ભાવે ધ્યાનમાં રાખવો, આ શેરમાં આગામી દિવસોમાં રૂ. ૨૮૪ અને તે પછી રૂ. ૨૯૨નો ભાવ આવી જવાની ગણતરી છે.

૩૩૮૬ વધીને ૮.૨૫ ઉપર આવ્યો છે. સહકારીય શેર છે અને હજી તેમાં રોકાણ જાળવી શકાય.

ગયા અંક વખતે રૂ. ૨૬૬૫ના ભાવનો **કિસોલનો** શેર લેવાની વાત

પરંતુ તે પછી હવે રૂ. ૨૬૦ અને તે પછી રૂ. ૨૭૦નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

રૂ. ૧૧૩ ઉપર આવી ગયેલા **તામિલનાડુ પેટ્રો પ્રોડક્ટ્સ**ના શેરમાં હજી લાંબી તેજની જગ્યા છે અને તેથી અડધા શેરોમાં પ્રોફિટ બુકીંગ કરીને અડધા શેરો જાળવી શકાય.

સિગારેટ બનાવતી કંપની **વીએસટી ઇન્ડસ્ટ્રીઝ** પણ અત્યારે ફૂલ તેજમાં દાખલ થઈ ગયો છે. અત્યારે રૂ. ૩૫૯ ઉપર ચાલે છે અને આવતા થોડા દિવસોમાં આ શેરમાં રૂ. ૩૬૭ અને તે પછી રૂ. ૩૮૦નો ભાવ આવી જવાની ગણતરી. બે કે ત્રણ શેરનું કામકાજ કરી શકાય.

નવી દિલ્હીની **એસઆરએફ**માં પણ લાંબી તેજની જગ્યા ફરી એક વખત દેખાય છે. રૂ. ૭૦૪૬વાળો શેર ફરી વખત મોટા પાયે કવર થવા લાગ્યો છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૭૨૨૭નો ભાવ જોવા મળવાની ગણતરી. બે કે ત્રણ શેરનું કામકાજ કરી શકાય.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો શેર રૂ. ૫૭૧ ઉપર છે અને ઓલિયો કેમિકલ્સ તેમજ અન્ય કેમિકલ્સનું ઉત્પાદન કરતી આ કંપનીમાં પણ જોરદાર તેજ શરૂ થવાની ગણતરી છે. નજીકના દિવસોમાં આ શેર રૂ. ૫૮૬ અને તે પછી રૂ. ૬૦૦નો ભાવ જોવા મળવાની ગણતરી.

ડ્રાઈવર ?

ડ્રાઈવર, રસોયા, નોકર શોધવા હવે પૂલ જ સરળ staffavailable.com

ના એકદમ અલગ પ્રકારના અને દેશમાં એકમાત્ર આવી સવલત એફર કરતાં પ્લેટફોર્મ ઉપર તમારી જરૂરિયાત મૂકી દો

તદ્દન ફી

staffavailable.com

Fastrack move on

Gopelia Sweet no more!

કરાવીએ છીએ. અત્યારે રૂ. ૨૫૫૩ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૨૫૭૫ ને તે પછીના ઉછાળે રૂ. ૨૬૬૨નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

સરકારી કંપની **ભારત ઇલેક્ટ્રોનિક્સ** કવર કરવાનું ગયા અંકમાં દર્શાવ્યું હતું અને તે પછી ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર ખૂબ સુંદર ઉછાળો બતાવ્યો. અત્યારે આ શેર રૂ. ૧૭૫ ઉપર આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં તેમાં ઝડપથી ભાવ વધે અને રૂ. ૧૮૫નું લેવલ આવી જાય તેવી ગણતરી છે.

આઈટી શેરોની સાથે ફિનાન્સીયલ સેક્ટરના શેરોમાં પણ ફેન્સી વધતી જાય છે અને તેમાં **પીરામલ એન્ટરપ્રાઇઝ** ખાસ ધ્યાન ખેંચે છે. છેલ્લા બે અઠવાડિયાથી આ શેર લેવાવાની મજબૂત છે.

માઈસ-ટી ઘણા સમયથી કવર કરાવીએ છીએ. અત્યારે રૂ. ૨૫૫૩ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૨૫૭૫ ને તે પછીના ઉછાળે રૂ. ૨૬૬૨નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

સરકારી કંપની **ભારત ઇલેક્ટ્રોનિક્સ** કવર કરવાનું ગયા અંકમાં દર્શાવ્યું હતું અને તે પછી ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર ખૂબ સુંદર ઉછાળો બતાવ્યો. અત્યારે આ શેર રૂ. ૧૭૫ ઉપર આવી ગયો છે અને આવતા થોડા દિવસોમાં તેમાં ઝડપથી ભાવ વધે અને રૂ. ૧૮૫નું લેવલ આવી જાય તેવી ગણતરી છે.

આઈટી શેરોની સાથે ફિનાન્સીયલ સેક્ટરના શેરોમાં પણ ફેન્સી વધતી જાય છે અને તેમાં **પીરામલ એન્ટરપ્રાઇઝ** ખાસ ધ્યાન ખેંચે છે. છેલ્લા બે અઠવાડિયાથી આ શેર લેવાવાની મજબૂત છે.

માઈસ-ટી ઘણા સમયથી કવર કરાવીએ છીએ. અત્યારે રૂ. ૨૫૫૩ ઉપર છે અને આવતા થોડા દિવસોમાં રૂ. ૨૫૭૫ ને તે પછીના ઉછાળે રૂ. ૨૬૬૨નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

ડે-ટ્રેડિંગમાં કેવી રીતે કમાવાય ?

ખૂબ જ ઓછા મૂકીરોકાણથી સાંકડાઈ લેવા માટે શેરબજારના લગભગ ૫૦ ટકા સોદાઓ ડે-ટ્રેડિંગના યાજ છે અને ડે-ટ્રેડિંગમાં કેવી રીતે શેર પસંદ કરવો અને ક્યારે તેમાં એન્ટ્રી લેવી તે અંગેની વિસ્તૃત સમજ આપતું આ અંગ્રેજી પુસ્તક છે. અને અમારા ડારા રૂ. ૨૬૫ની મૂળ કિંમતનું આ પુસ્તક ખાસ ડિસ્કાઉન્ટ કિંમતમાં એફર થયું છે. રૂ. ૨૬૫-૨૫ = રૂ. ૨૪૦

ઓનલાઇન ખરીદો GyanPothi.com

શેરબજારનું ટેકનિકલ એનાલિસીસ સમજો

ચાલકના દર અંકમાં સાઈ એનાલિસીસ આપીએ છીએ. આ એનાલિસીસ સમજવા ડો. હર્ષદ કમદાર લિખિત એક ગુજરાતી પુસ્તક રચાય છે. ડો. હર્ષદ કમદાર ડારા સરળ ભાષામાં સાઈ એનાલિસીસની સમજ આપી છે. આ પુસ્તક ખરીદવા ચાલકવ જુદા ડારા ખાસ રૂ. ૧૫ ડિસ્કાઉન્ટ રૂ. ૧૨૦-૧૫ = રૂ. ૧૦૫

ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર

આ પુસ્તક અત્યારે અંગ્રેજી અને હિન્દીમાં ઉપલબ્ધ છે પરંતુ આ પુસ્તકને શેરબજારના બાઈબલ તરીકે વિશ્વભરમાં ઓળખાતાં આવે છે અને શેરબજાર અંગે કશું પણ શીખવા માંગતા ઇન્વેસ્ટરે આ પુસ્તક ભલે વાંચો નહિ પરંતુ દરરોજ રાત્રે માથા નીચે મૂકીને સૂઈ જવા માટે જોગ્ય કહી શકાય.

ઓનલાઇન ગોઠાવ ડારા લખાયેલા આ પુસ્તકની વિસ્તૃત અભ્યાસ વિશ્લેષણ સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોલેન ગ્રાહમ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ પુસ્તકની એકેએક સલાહ વોલેન ગ્રાહમે તેમના યુવાનમાં અપનાવી છે અને કદાચ તેને કારણે તેઓ જોરદાર સફળ થયા.

આ પુસ્તક ખરીદવા ચાલકવ જુદા ડારા ખાસ રૂ. ૭૯૯ રૂ.

ઓનલાઇન ખરીદો GyanPothi.com

GooglePay ૯૮૨૪૨૩૨૪૨૪ ડારા પણ પેમેન્ટ કરી શકાશે પેટીએમ ૯૮૨૪૨૩૨૪૨૪ ડારા પણ પેમેન્ટ કરી શકાશે

રૂ. ૧૦૨૫ના ભાવના **ગોડફ્રે કલેરિયન્ટ ઇન્ડસ્ટ્રીઝ**ના શેરમાં સુંદર ઉછાળાની ગણતરી છે અને તે શેર ઉપર ફોકસ રખાય.

રૂ. ૧૦૬.૭૫ના ભાવે મળી રહેલો **જેએસએલ લિમિટેડ** પણ આવતા થોડા દિવસોમાં ઝડપથી રૂ. ૧૨૦ ઉપર આવી જાય તો નવાઈ નહિ લાગે. ચારેક અઠવાડિયાના એન્ગલથી તેમાં થોડાક શેર લઈને મૂકી દેવાય.

શોર્ટટર્મ ખેલાડીઓનું કોલેક્સ ફરી એક વખત **આદાલી એન્ટરપ્રાઇઝ**ના શેરમાં વધતું જાય છે. આ શેર નબળા માહોલ વચ્ચે પણ રૂ. ૧૫૧૯ ઉપર તો આવી ગયો અને આવતા થોડા દિવસોમાં એકદમ ધીરે ધીરે વધીને રૂ. ૨૬૦૫ના ભાવે ધ્યાનમાં રખાય. આવતા થોડા દિવસોમાં રૂ. ૨૬૪૬ અને તે પછી રૂ. ૨૭૦૦નો ભાવ જોવા મળવાની ગણતરી.

૧૫૧૫નો ભાવ જોવા મળવાની ગણતરી છે. એકદમ ધીમા સુધારા સાથે રૂ. ૩૮૦૦ના ભાવની ગણતરી.

૨૨૨૨ના ભાવની સંભાવના મજબૂત.

મારૂટી, નવા મોડલો લોન્ચ કરવાના ૧લી જુલાઈથી ભાવ વધારો પણ આવે છે. નફો સુધરશે, રૂ. ૭૫૩૦વાળા આ શેરમાં આકર્ષણ અને આવતા થોડા દિવસોમાં જ આ શેરમાં મજબૂત ઉછાળા સાથે રૂ. ૭૬૦૬નો ભાવ

૬૨૦નો ભાવ જોવા મળવાની ગણતરી. બેરિંગ બનાવતી કંપની **સ્કેફલર ઇન્ડિયા**નો શેર અત્યારે રૂ. ૫૬૦૪ ઉપર ચાલે છે અને આવતા થોડા દિવસોમાં તેમાં રૂ. ૫૮૫૮નો ભાવ જોવા મળવાની ગણતરી.

ગ્લેનમાર્ક ફાર્માનો શેર હવે વધવા લાગ્યો છે. પેટા કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે અને તેનો ફાયદો દેખાશે. ગ્લેનમાર્ક અત્યારે રૂ. ૬૪૬ ઉપર છે અને તેમાં ત્રણેક અઠવાડિયામાં સુંદર ઉછાળાની જગ્યા. ઉપરમાં રૂ. ૬૫૨ અને તે પછી રૂ. ૬૬૦નો ભાવ જોવા મળવાની ગણતરી.

શોમસફ્ટનો શેર અત્યારે રૂ. ૬૪-૬૫ આસપાસ અથડાઈ રહ્યો છે. એક તબક્કે રૂ. ૭૦નું ટોપ આગલા અઠવાડિયે જોવાયું હતું અને થોડુંક પ્રોફિટ બુકીંગ પત્યા પછી આ શેરમાં નવી તેજની ગણતરી છે અને તેથી રૂ. ૬૪-૬૫ના ભાવે રોકાણ જાળવી શકાય. ઉપરમાં રૂ. ૭૧-૭૨નો ભાવ જોવા મળવાની ગણતરી.

તાતા એલેક્સી અત્યારે રૂ. ૩૭૬૮ ઉપર ચાલે છે અને આગામી દિવસોમાં આ શેરમાં પણ ખૂબ સુંદર ઉછાળાની ગણતરી છે. તાતા એલેક્સી આ વખતે રૂ. ૪૦૦૦નું લેવલ કુદાવી દે તે સંભાવના મજબૂત છે અને તેથી ત્રણ કે ચાર શેર લઈને મૂકી શકાય.

શોર્ટટર્મ ખેલાડીઓની ફેન્સી અત્યારે રૂ. ૮૬૩ વાળા **ફેન્ટા** શેરમાં પણ છે. સ્ટાર બજાર અને વેસ્ટસાઈડ જેવી મજબૂત રીટેઈલ શુંભલા પરાવતી આ કંપનીમાં આગામી દિવસોમાં રૂ. ૮૮૦ અને તે પછી રૂ. ૯૦૦ના ભાવની સંભાવના મજબૂત છે.

ગેસ્ટાર ટેકનોલોજીનો શેર ક્રેકશન પૂર્ણ કરીને હવે તેજબરફી થયો છે અત્યારે રૂ. ૩૦૫ ઉપર છે અને તે શેરમાં આવતા થોડા દિવસોમાં સુંદર ઉછાળાની ગણતરી છે. જ પ્રકારે રૂ. ૧૫૦૦ ઉપરના **લમ્પેક્સ**ના શેરમાં પણ નવી તેજના સંકેત મળી રહ્યા છે. આ શેર ધ્યાનમાં રખાય અને તેમાં પણ ઝડપી ઉછાળાની જગ્યા છે.

પીડીલાઈફ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે રૂ. ૨૧૩૪ ઉપર છે અને તેમાં પણ નવા ઝડપી ઉછાળાની ગણતરી. થોડાક શેરો લઈને મૂકી શકાય.

રૂ. ૧૭૪ ઉપર આવી ગયેલા **સિટી યુનિયન બેંક**ના શેરમાં પણ હવે મજબૂત સુધારો શરૂ થઈ ગયો છે. અગાઉ દર્શાવ્યું તેમ પ્રાઈવેટ સેક્ટર

બંકોમાં આ વખતે મજબૂત ઉછાળાની ગણતરી. અને તેમાં રૂ. ૧૭૪૫વાળો સિટી યુનિયન બેંક ઝડપથી રૂ. ૨૦૦૦નું લેવલ કુદાવી દે તો નવાઈ નહિ લાગે. ત્રણ-ચાર અઠવાડિયાના એન્ગલથી થોડાક શેર લઈને મૂકી શકાય.

રૂ. ૧૨૨૭ ઉપરના **નિરલા કોર્પોરેશન**ના શેરમાં પણ સુંદર ઉછાળાની ગણતરી અને તે શેરમાં પણ ફોકસ રાખવું. જ્યારે રૂ. ૪૦૮૦વાળા **ગુજરાત આલ્કલી**ના શેરમાં ટૂંકી વધઘટનો ટ્રેન્ડ રહેવાની ગણતરી છે.

તાતા સ્ટીલ ઊંચેસએલે હવે ક્રેકશન પૂર્ણ કર્યું છે. થોડા દિવસોથી આ શેર નબળાઈ અને પ્રોફિટ બુકીંગના તબક્કામાં હતો. ઉપરમાં રૂ. ૧૧૦૦નું લેવલ બતાવ્યા પછી અત્યારે રૂ. ૯૧૬.૦૮ ઉપર આવી ગયો છે. હજી બે-ત્રણ નબળાઈ બતાવ્યા પછી આ શેરમાં ઝડપી તેજ જોઈ શકાશે. જૂન ક્વાર્ટરના પરિણામ નજીક આવે ત્યાં સુધી રાહ જોવાની.

મુથુર ફિનાન્સમાં પણ પરિણામોના સુંદર સપોર્ટ પછી આકર્ષણ વધતું જાય છે. મુથુર ફિનાન્સ અત્યારે રૂ. ૧૪૮૫ ઉપર આવી ગયો છે અને તેમાં પણ લગભગ બે મહિનાની લાંબી તેજ જોવાવાની ગણતરી. ઉપરમાં રૂ. ૧૫૦૫ નજીકના દિવસોમાં જ જોવા મળે.

એપોલો હોસ્પિટલનો શેર ધીરે ધીરે વધીને રૂ. ૩૭૮૯ ઉપર આવ્યો છે અને આ શેરમાં પણ આવતા થોડા દિવસોમાં રૂ. ૩૮૦૦નો ભાવ જોવા મળવાની ગણતરી. અને તે પછીના ઉછાળે રૂ. ૩૯૧૬નો ભાવ જોવા મળશે.

આઈટી સેક્ટરમાં **એલએસટી ઇન્ફોટેક** રૂ. ૪૨૧૫ના ભાવે ધ્યાનમાં રાખવો અને આવતા થોડા દિવસોમાં રૂ. ૪૨૬૨ અને તે પછી ધીરે ધીરે રૂ. ૪૩૪૩નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

આઈસીઆઈસીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ અત્યારે રૂ. ૧૫૨૫ ઉપર છે અને તેમાં પણ નવી તેજ શરૂ થવાની ગણતરી. રોકાણ જાળવી શકાય.

આલ્ટેમ લેબ્સનો શેર અત્યારે રૂ. ૩૫૪૨ ઉપર આવી ગયો છે. અમેરિકા ખાતે જોરદાર વેચાણો છે અને તેનો ફાયદો નફાશક્તિ ઉપર જોઈ શકાશે. રોકાણ જાળવી રાખવું.

યુનાઇટેડ લુવરીનો શેર કવર કરવાનું છેલ્લા ત્રણ-ચાર અંકથી સતત

PRATIKSHA CHEMICALS LIMITED					
REGD. OFFICE: 3RD FLOOR, H K COMPLEX, OPP. DHARNIDHAR DERASAR, VASNA, AHMEDABAD - 380007					
CIN : L24110GJ1991PLC015507 www.pratikshachemicals.in					
PH : 079-2662390 E-MAIL: exports@dharrapratiksha.com					
EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31.03.2021 (Rs. In Lacs)					
Sr. No	PARTICULARS	Quarter ended on 31st March, 2021	For the year ended on 31st March, 2021	Comprising 3 Months Ended on 31st March, 2020	For the previous year ended on 31st March, 2020
1	Total income from operations	446.80	1136.12	376.34	1610.01
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	12.587	42.64	(3.95)	11.46
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary items)	12.587	42.64	(3.95)	11.46
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	16.69	46.64	(28.01)	(15.99)
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	16.69	46.64	(28.01)	(15.99)
6	Equity Share Capital	557.03	557.03	557.03	557.03
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year	(232.46)	(232.46)	(279.10)	(279.10)
8	Earnings Per Share (of Rs. 10 / - each) (for continuing and discontinued operations)	0.30	0.84	(0.50)	(0.29)
	Diluted :	0.30	0.84	(0.50)	(0.29)

Notes:
1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full Format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.pratikshachemicals.com)
2. The result of the Quarter ended on 31st March, 2021 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 29th June, 2021.

BY ORDER OF THE BOARD OF DIRECTORS, FOR, PRATIKSHA CHEMICALS LIMITED SD/-
Mr. UPENDRA ADHVARYU DIRECTOR (DIN : 00483857)

Place : Ahmedabad Date : 29th June, 2021

તામિલનાડુ ન્યુઝ ઇન્ટ અને અન્ય પેપર શેરોમાં પણ ફેન્સી વધતી જાય છે. તામિલનાડુ ન્યુઝપ્રીન્ટ રૂ. ૧૭૩ ઉપર છે અને આગામી દિવસોમાં રૂ. ૧૮૨નો ભાવ આવી જવાની ગણતરી.

કેઈસી ઇન્ટરનેશનલના શેરમાં પણ આકર્ષણ વધ્યું છે. અત્યારના રૂ. ૪૫૬ વાળો શેર આવતા થોડા દિવસોમાં રૂ. ૪૬૨ અને તે પછી રૂ. ૪૮૨નો ભાવ બતાવી દે તો નવાઈ નહિ લાગે.

લાઈફ ઇન્સ્યોરન્સ પોલિશીની માંગ વધી હોવાથી **આઈસીઆઈસીઆઈ પ્રૂ. લાઈફ**નો શેર રૂ. ૬૧૬ના ભાવે ધ્યાનમાં રાખવો અને આ શેરમાં પણ આગામી દિવસોમાં ઝડપી ઉછાળો રૂ. ૬૨૬ અને તે પછી રૂ. ૬૫૬નો ભાવ જોવા મળવાની ગણતરી છે.

એન્ટિનિયરીંગ અને ઓટોમોબાઈલ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓમાં ભાવ વધતો જાય છે અને તેમાં બેરિંગ બનાવતી કંપની **એસકેએફ ઇન્ડિયા**નો શેર રૂ. ૨૬૦૫ના ભાવે ધ્યાનમાં રખાય. આવતા થોડા દિવસોમાં રૂ. ૨૬૪૬ અને તે પછી રૂ. ૨૭૦૦નો ભાવ ક્યાં આવી જશે તે પણ ખબર નહિ પડે.

બજાર હિન્દુસ્તાનનો શેર છેલ્લા ચાર અઠવાડિયાથી લેવાવાઈએ છીએ. અંક નં. ૧૦માં રૂ. ૧૨.૨૫ના ભાવે આ શેર લેવાની વાત કરી હતી અને તે પછી લગભગ ૩૩ ટકા વધીને અત્યારે રૂ. ૧૭.૬૫ ઉપર આવ્યો છે. હજી થોડો વખત જાળવી શકાય અને હવેના ઉછાળે રૂ. ૧૮નો ભાવ જોવા મળવાની ગણતરી.

તેવી જ રીતે ૭મી જૂનના અંકમાં રૂ. ૬ના ભાવે **રોલેટ**નો શેર લેવાની વાત કરી હતી અને રોલ્ટા પણ અત્યારે

કરી હતી અને અત્યારે આ શેર એક તબક્કે રૂ. ૧૦૦ વધ્યા પછી રૂ. ૨૬૪૮ ઉપર છે અને હજી પણ આ શેરમાં સુંદર ઉછાળાની જગ્યા દેખાય છે.

સેન્યુરી એન્ડાનો શેર પણ છેલ્લા ત્રણ-ચાર અંકથી લેવાવાઈએ છીએ. ૭ જૂનના અંકમાં પણ લેવાવાઈએ અને અત્યારે રૂ. ૪૦૫ ઉપર ચાલે છે અને આગામી દિવસોમાં આ શેરમાં ઝડપી ઉછાળાની ગણતરી છે.

રૂ. ૫૮૪ના ભાવના **કલેરિયન્ટ ઇન્ડસ્ટ્રીઝ**ના શેરમાં સુંદર ઉછાળાની ગણતરી છે અને તે શેર ઉપર ફોકસ રખાય.

રૂ. ૧૦૬.૭૫ના ભાવે મળી રહેલો **જેએસએલ લિમિટેડ** પણ આવતા થોડા દિવસોમાં ઝડપથી રૂ. ૧૨૦ ઉપર આવી જાય તો નવાઈ નહિ લાગે. ચારેક અઠવાડિયાના એન્ગલથી તેમાં થોડાક શેર લઈને મૂકી દેવાય.

શોર્ટટર્મ ખેલાડીઓનું કોલેક્સ ફરી એક વખત **આદાલી એન્ટરપ્રાઇઝ**ના શેરમાં વધતું જાય છે. આ શેર નબળા માહોલ વચ્ચે પણ રૂ. ૧૫૧૯ ઉપર તો આવી ગયો અને આવતા થોડા દિવસોમાં એકદમ ધીરે ધીરે વધીને રૂ. ૧૫૫૫નો ભાવ જોવા મળવાની ગણતરી છે. એકદમ ધીમા મોડેલોમાંથી બહાર આવ્યો હોવાથી આ શેર હજી થોડા દિવસોમાં મંદ ચાલશે પરંતુ તેમાં ફરી એક વખત તોફાન નક્કી છે.

ફિલિપ્સ કે જે અગ્રણી સિગારેટ કંપની છે તેમાં પણ સુંદર ઉછાળાની તૈયારી, રૂ. ૧૦૨૫થી વધીને આ શેર રૂ. ૧૧૨૫નો ભાવ ક્યાં બતાવી દેશે તે પણ ખબર નહિ પડે, પાંચેક શેરનું કામકાજ કરી શકાય.

કાગળ ઉદ્યોગની ટોચની કંપની **વેસ્ટકોસ્ટ પેપર**નો શેર રૂ. ૨૪૬ ઉપર ચાલે છે. શુક્રવારે થોડોક દબાયો હતો

ગામની ગપસપ

■ **ઇન્ડેક્સ**, નવા ડેરિવેટીવની શરૂઆત એકંદરે પોઝિટિવ માહોલમાં થઈ. આગામી દિવસોમાં અનલોકકાઉનને કારણે વિવિધ સેક્ટરનું કામકાજ સુધરવાનું, આશાવાદ વધ્યો છે. ખાસ કરીને આઈટી, બેંક અને એક્ઝેમ્પ્લિસ શેરોની પાછળ સેન્સેક્સ અને નિફટી ઉચકાય.

■ **તાતા કન્સ્યુમર**, થોડા દિવસો પહેલા જ રૂ. ૬૩૦ ઉપર હતો અને ગણતરીના દિવસોમાં રૂ. ૭૫૭ ઉપર આવ્યો છે. આવતા થોડા દિવસોમાં રૂ. ૭૮૫-૮૦૦ના ભાવની ગણતરી.

■ **ટાઈટન**, સોનામાં હોલમાર્કનો પ્રારંભ અને તેમ છતાં સૌથી વધારે આકર્ષણ ટાઈટનના શેરમાં, સાડીના વિશાળ નવા બિઝનેસમાં પણ દાખલ થઈ છે. રૂ. ૭૨૪ ઉપર આવી ગયેલી એચડીએફસી લાઈફમાં આવતા થોડા દિવસોમાં રૂ. ૭૩૩ના ભાવની ગણતરી, થોડાક શેરો લઈને મૂકી શકાય.

■ **અદ્વાટેક સિમેન્ટ**, અત્યાર સુધી સરકારી સેક્ટરને કારણે જ માંગ હતી હવે પ્રાઈવેટ સેક્ટરની માંગ નીકળવા રૂ. ૬૯૮૦ ઉપરના અલ્ટ્રાટેકમાં લાંબી તેજનો પ્રારંભ, પાંચેક શેર લઈને મૂકી શકાય. શોર્ટટર્મમાં રૂ. ૭૦૩૦ અને તે પછી ધીરે ધીરે રૂ. ૭૨૭નો ભાવ જોવા મળવાની ગણતરી. થોડાક અઠવાડિયાના એન્ગલથી પણ લઈ શકાય.

■ **હિન્દુસ્તાન યુનિવિર**, દેશની સૌથી મોટી એક્ઝેમ્પ્લિસ કંપની, સારા સોમાસાનો ફાયદો મળવાનો, અનલોકકાઉનને કારણે પ્રાથમિક માંગ અંગે પણ આશાવાદ, શેર અત્યારે વધીને રૂ. ૨૪૬૫ ઉપર આવી ગયો છે. આવતા થોડા દિવસોમાં રૂ. ૨૫૫૨ના ભાવની સંભાવના મજબૂત.

■ **ફિલિપ્સ**ના **ઇન્ડસ્ટ્રીઝ**, એક્ઝેમ્પ્લિસ કંપનીઓ અને ખાસ કરીને બિસ્કિટ બનાવતી કંપનીઓ માટે સારો સમય, અત્યારના રૂ. ૩૮૮૯ના ભાવે ધ્યાનમાં રખાય. ધીમા સુધારા સાથે રૂ. ૩૮૦૦ના ભાવની ગણતરી.

■ **એસબીઆઈ લાઈફ**, છેલ્લા ઘણા સમયથી ભેગા કરવાનું દર્શાવીએ છીએ. આખરે રૂ. ૧૦૦૦ કુદાવીને રૂ. ૧૦૦૨ ઉપર આવ્યો છે. જાળવી રાખજો, એકદમ ધીમા સુધારા સાથે રૂ. ૧૧૦૦ના ભાવની ગણતરી.

■ **એચડીએફસી બેંક**, સિરાજ વ